



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૩/૦૬/૨૦૧૯ ગુરુવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૦૭/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૮૮ કેસ કરી, ૭૪ વ્યક્તિઓને ઝડપી, ૧૩૦૦ લીટર દેશી દારૂ, ૬૦૦ બોટલ ઈંગ્લીશ દારૂ, ૦૯ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ, ૧૨ બિયર બોટલ, ૧૬૪ બિયર ટીન, ૦૨ કાર, ૦૧ સ્કુટર અને ૧ રિક્ષા કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૦૪ કેસ કરી ૦૪ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨૪,૩૯૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૦૮/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૯૩ વ્યક્તિઓની અને પ્રોહી.૯૩ હેઠળ ૦૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ધરફોડ :-

સમાચાર યાદી નં.૧૦૦૯/૧૯

નારોલ : નંદકિશોર પુરણમલ અગ્રવાલ (ઉ.વ.૫૦)(રહે. કર્ણાવતી-૦૩ માનશીપાર્ક સોસાયટીની પાસે મણીનગર) એ તા.૧૨/૦૬/૨૦૧૯ ના રોજ નારોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૩/૦૬/૨૦૧૯ રાતના ૮/૩૦ થી તા.૦૪/૦૬/૨૦૧૯ ના કલાક ૮/૩૦ વાગ્યા દરમ્યાન નારોલ વૈશાલીનગર ખાતે આવેલ શ્રી રામ એસ્ટેટ-૦૨ માં આવેલ પોતાના “પુલકિત ફેશન” નામના ગોડાઉનના શટરનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ ગોડાઉનમાં પ્રવેશ કરી, કાપડની ગાંસડીઓમાં પેકીંગ કરેલ કુલ ૨૧૩૨ મીટર કાપડ અંદાજિત કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી આર.એ.જાદવ ચલાવે છે.

બાપુનગર : તુલસીભાઈ મુળજીભાઈ પટેલ (ઉ.વ.૭૦)(રહે.બજરંગ સોસાયટી આનંદ ફ્લેટ ની બાજુમાં બાપુનગર) એ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૧/૦૬/૨૦૧૯ ના કલાક ૧૨/૦૦ થી સાંજના ૫/૦૦ સુધીના સમયગાળા દરમ્યાન પોતાના મકાનનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ મકાનમાં પ્રવેશ કરી, તીજોરીમાંથી રોકડ રૂપિયા ૩૦,૦૦૦/-, ગેસનો બાટલો અને સગડી કિંમત રૂપિયા ૫,૦૦૦/-, ધરવખરી નો સામાન કિંમત રૂપિયા ૫,૦૦૦/- તથા કબાટ કિંમત રૂપિયા ૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૪૫,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એમ.ગઢવી ચલાવે છે.

ઇસનપુર : દિપકકુમાર નરહરીલાલ શેઠ (ઉ.વ.૬૫)(રહે.શક્તિ ટેનામેંટ શાંતિબાગ સોસાયટી ની બાજુમા મોની હોટલની સામે ઇસનપુર) એ ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૧/૦૬/૧૯ રાતના ૧૦/૪૫ થી તા.૧૨/૦૬/૧૯ સવારના ૫/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના પાછળના દરવાજાનું હુક કોઇ સાધન વડે તોડી, અજાણી વ્યક્તિ મકાનમા પ્રવેશ કરી, તીજોરીમાંથી રોકડ રૂપિયા ૫૦,૦૦૦/- તથા સોના-ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૫૭,૫૦૦/- મળી કુલ રૂપિયા ૧,૦૭,૫૦૦/- મતાની ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એન.જે.મારૂ ચલાવે છે.

સોનાની ચેઇન ખેંચી તોડી લઇ ગયો :-

સમાચાર યાદી નં.૧૦૧૦/૧૯

ઇસનપુર : શ્વેતાબેન ઉર્વીશકુમાર પટેલ (ઉ.વ.૩૫)(રહે.જ્યુલીપાર્ક સોસાયટી, જયમાલા બસ સ્ટેન્ડ પાસે ભાડુઆતનગર ઇસનપુર) તા.૧૨/૦૬/૧૯ ના કલાક ૯/૩૦ વાગ્યાના સુમારે ઇસનપુર મ્યુનિ. સ્કુલ સામે ઓમ પરમાત્મા સોસાયટીમાં ઓસરીમા કચરો વાળતા હતા ત્યારે સરનામુ પૂછવાના બહાને એક્ટીવા ઉપર આવેલ એક અજાણ્યો પુરૂષ શ્વેતાબેનના ગળામાંથી સોનાની પેંડલ સહિતની ચેઇન કિંમત રૂપિયા ૧૫,૦૦૦/- મતાની ખેંચી તોડી લઇ નાસી ગયો હતો. આ અંગે શ્વેતાબેન પટેલ એ ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એન.જે.મારૂ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.